



**I B Patel English School (Primary)**

**2020 -2021**

**Class – 6**

**EXERCISE**

**Subject – Gujarati**

**Chapter : 1 (નાવડી ચાલી)**

**પ્રશ્ન ૧. નીચેના પ્રશ્નોના ઉત્તર એક- એક વાક્યમાં લખો.**


૧. કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા?
૨. પાણીમાં કોણ કૂદી પડ્યું હતું?
૩. તરતાં કોને આવડતું નહોતું?
૪. પીલું ઝડપથી શું લઈ આવ્યું હતું?
૫. નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું?

**પ્રશ્ન ૨. ઉદાહરણ મુજબ વાક્યપ્રયોગ કરો.**

૧. દેડકો : દેડકો પાણીમાં ડૂાઈ ડૂાઈ કરે છે.
૨. ચકલી : \_\_\_\_\_
૩. ઉંદર : \_\_\_\_\_
૪. કબુતર : \_\_\_\_\_
૫. કાગડો : \_\_\_\_\_

**પ્રશ્ન ૩. તમારી વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરો.**

પ્રશ્ન ૪. નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.



૧. ચિત્ર શાનું છે?
૨. છોડ કોણ રોપે છે?
૩. છોકરો શું કરે છે?
૪. તમને કેટલા વૃક્ષો દેખાય છે?
૫. ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે?
૬. વૃક્ષ વિશે બીજા બે સૂત્રો લખો

પ્રશ્ન ૫. કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો.

(બોડ, રાફડો, દર, માળો, વાડો, ઘર )

૧. ઉંદરનું રહેઠાણ - \_\_\_\_\_
૨. વાઘ - વરુનું રહેઠાણ- \_\_\_\_\_
૩. પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે - \_\_\_\_\_.

૪. બકરી- ઘેટાંને જ્યાં પૂરવામાં આવે છે તે-\_\_\_\_\_

૫. માણસનું રહેઠાણ- \_\_\_\_\_

૬. સાપનું રહેઠાણ - \_\_\_\_\_

પ્રશ્ન ૬. કૌંસમાં આપેલ આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

(શાકભાજી, પંખી, રંગ, ઋતુ, માસ, ફળ, સંબંધ)

૧. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ -

૨. સફરજન, દાડમ, કેરી -

૩. રાતો, પીળો, લાલ -

૪. શિયાળો, ઉનાળો, ચોમાસુ -

૫. કાકા, કુઆ, માસી -

૬. દુધી, કારેલા, ભીંડા -

૭. મોર પોપટ, કાબર-

પ્રશ્ન ૭. સૂચના મુજબ કરો.

૧. 'ક' અક્ષરથી શરૂ થતી ઘરમાંની પાંચ વસ્તુના નામ લખો.

૨. દરેક વસ્તુનો એક-એક ઉપયોગ લખો.

## ANSWER KEY

પ્રશ્ન ૧. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો.

૧. કીડી અને ભમરાની સાથે દેડકો, પીલુ અને ઉંદર ફરવા નીકળ્યા હતા.
૨. પાણીમાં દેડકો કૂદી પડ્યો.
૩. પીલુ, ઉંદર, કીડી અને ભમરાને તરતા નહોતું આવડતું.
૪. પીલુ ઝડપથી એક પાંદડું લઈ આવ્યું.
૫. નાવડી બનાવવા પીલુ એક પાંદડું, ઉંદર એક નાળિયેરની કાચલી, કીડી લાકડી અને ભમરો દોરી લઈ આવ્યો.

પ્રશ્ન-૨. ઉદાહરણ મુજબ વાક્યપ્રયોગ કરો.

૧. દેડકો : દેડકો પાણીમાં ડૂાઈ ડૂાઈ કરે છે.
૨. ચકલી : ચકલી ચીં... ચીં...ચીં.... કરે છે.
૩. ઉંદર : ઉંદર ચું... ચું.... ચું.. કરે છે.
૪. કબુતર : કબુતર ઘૂં... ઘૂં.... ઘૂં....કરે છે.
૫. કાગડો : કાગડો કા...કા...કા...કરે છે.

પ્રશ્ન-૩. તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે, તેનું વર્ણન કરો.

મારા વર્ગખંડની બારીમાંથી દૂર થોડાક વૃક્ષો દેખાય છે. પવન આવતા વૃક્ષો ઝૂમી રહ્યા છે કેટલાક બાળકો વૃક્ષ નીચે રમી રહ્યા છે. શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ વોલીબોલ રમી રહ્યા છે. આકાશમાં વાદળો અહીં તહીં દોડી રહ્યા છે. કેટલાક પક્ષીઓ ઉડવા નો આનંદ લઈ રહ્યા છે.

પ્રશ્ન : ૪ નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.

૧. ચિત્ર વૃક્ષારોપણનું છે.
૨. છોકરી છોડ રોપે છે.

૩. છોકરો છોડને પાણી પાય છે.
૪. અમને ચિત્રમાં છ વૃક્ષો દેખાય છે.
૫. ચિત્ર દ્વારા આપણને 'વધુ વૃક્ષ વાવો' ની શીખ મળે છે.
૬. (૧.) વૃક્ષો વાવો વરસાદ લાવો  
(૨.) વૃક્ષ એટલે ધરતીના શણગાર

પ્રશ્ન ૫. કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો.

૧. ઉંદરનું રહેઠાણ - દર
૨. વાઘ- વરુનું રહેઠાણ- ખોડ
૩. પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે - માળો
૪. બકરી- ઘેટાંને જ્યાં પૂરવામાં આવે છે તે- વાડો
૫. માણસનું રહેઠાણ - ઘર
૬. સાપનું રહેઠાણ- રાફડો

પ્રશ્ન ૬. કૌંસમાં આપેલ આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

૧. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ - માસ
૨. સફરજન, દાડમ, કેરી - ફળ
૩. રાતો, પીળો, લાલ - રંગ
૪. શિયાળો, ઉનાળો, ચોમાસુ - ઋતુ
૫. કાકા, કુઆ, માસી - સંબંધ
૬. દુધી, કારેલા, ભીંડા - શાકભાજી
૭. મોર, પોપટ, કાબર - પંખી

પ્રશ્ન ૭. સૂચના મુજબ કરો.

૧. 'ક' અક્ષરથી શરૂ થતી ઘરમાંની પાંચ વસ્તુના નામ લખો.

જ: કુકર, કબાટ, કાતર, કુંજો, કલમ

૧. કુકરમાં ખાવા બનાવી શકાય છે.

૨. કબાટમાં વસ્તુઓ મૂકવામાં આવે છે.

૩. કોઈ વસ્તુ કાપવા કાતરનો ઉપયોગ થાય છે.

૪. કુંજામાં છોડ રોપવામાં આવે છે.

૫. કલમથી સરસ લખી શકાય છે.